

ત્વરિત જાહેરાત માટે

COVID-19ના ઉપદ્રવને ફેલાતો રોકવા માટે સીટી ઓફ બ્રેમ્પટન બાર, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓને ઈન-પર્સન (એટલેકે રૂબરૂમાં અપાતી) સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે

બ્રેમ્પટન, ઓન્ટારિઓ (16 માર્ચ 2020) – COVID-19ના ઉપદ્રવને ફેલાતો રોકવા માટે સીટી ઓફ બ્રેમ્પટન બાર, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓને ઈન-પર્સન (એટલેકે રૂબરૂમાં અપાતી) સેવાઓ બંધ કરવાની પ્રોવિન્સ ઓફ ઓન્ટારિઓની આજે જાહેર કરાયેલ સૂચના અનુસરતા પીલ પબ્લિક હેલ્થને સીટી ઓફ બ્રેમ્પટન સમર્થન આપે છે.

ઉપરાંત, પીલ પબ્લિક હેલ્થ ભારપૂર્વક સૂચિત કરે છે કે નાઈટ ક્લબ્સ, મૂવી થિએટરો અને કન્સર્ટના વેન્યૂઝ 17 માર્ચ 2020ના રોજ રાતે 12:01થી બંધ રહે.

પીલ પબ્લિક હેલ્થ સર્વેજાણને સામાજિક વ્યવહારોમાં અંતર રાખવાનું (social distancing) આલ્વાહન કરે છે. સામાજિક વ્યવહારોમાં અંતર રાખવું એટલે શારીરિક સંપર્ક ટાળવો અને અન્ય લોકોથી એક સલામત અંતર (આશરે ૨ મીટર) રાખવું.

પીલ પબ્લિક હેલ્થ અતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે રહેવાસીઓ જેઓએ યુનાઈટેડ સ્ટેટ્સ સહિત કેનેડા બહાર પ્રવાસ કર્યો હોય તેઓએ 14 દિવસ સુધી પોતાની જાતને અળગી રાખવી (isolate) જોઈએ.

જોવામાં આવે છે કે જ્યારે રેસ્ટોરન્ટ, બાર અને ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓએ અગાઉથી જ લોકકલ્યાણની ભાવનાથી સ્વેચ્છાએ પીલના નિવાસીઓને સુરક્ષિત રાખવા હેતુ પોતે કેવી રીતે વેપાર કરે છે તેમાં ફેરફારો લાવ્યા છે, એવી કોઈ પણ વેપારી પેઢી જે પ્રોવિન્સ અથવા પીલ પબ્લિક હેલ્થની ભલામણોનું ઉલ્લંઘન કરશે તેઓએ હેલ્થ પ્રોટેક્શન એન્ડ પ્રમોશન એક્ટ (Health Protection and Promotion Act) હેઠળ થયેલ હુકમની અવગણના કરેલ ગણાશે.

સિટી ઓફ બ્રેમ્પટન નગરજનોને સ્થાનિક ખાદ્ય સેવા સંસ્થાઓને ટેક આઉટ અને પિક અપ જેવા ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને ટેકો આપવા પ્રોત્સાહિત કરે છે.

સિટીની સેવાઓ અને બંધ રહેલ સવલતો અને પ્રોગ્રામિંગ વિશે બિલકુલ તાજેતરના અપડેટ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) માટે અહીં www.brampton.ca/covid19 ની મુલાકાત લેવા વિનંતી છે.

પીલ પબ્લિક હેલ્થ માહિતી પરથી અદ્યતન માહિતી માટે મુલાકાત લો: www.peelregion.ca/coronavirus.

અવતરણ

"આગળ વધવા અને સમાજમાં COVID-19 ના ઉપદ્રવનો ફેલાવો રોકવામાં સહાય માટે ઝડપી, સામૂહિક પગલાંની જરૂર છે. સિટી ઓફ બ્રમ્પટન સમાજની સુરક્ષાને અગ્રિમતા આપવા હેતુ, પીલ પબ્લિક હેલ્થ દ્વારા આજે આપેલ ભલામણોને સંપૂર્ણપણે સમર્થન આપે છે જેમાં રેસ્ટોરન્ટ, બાર અને કોફી શોપ્સ સહિતની તમામ ખાદ્ય પદાર્થ વેચતી સંસ્થાઓની ડાઈન-ઇન સેવાઓને હંગામી ધોરણે બંધ કરવાની છે. સિટી ઓફ બ્રમ્પટન COVID-19 સામે લેવાયેલ અભૂતપૂર્વ પગલાંનો પ્રભાવ લોકોના જીવન પર ઓછામાં ઓછો થાય તે માટે પ્રતિબદ્ધ છે. આ સમયે આપણે સહુ એક જ સમુદાય તરીકે સંપીને રહીએ તે અતિમહત્વપૂર્ણ છે અને હું આપતા સખ્તાહોમાં આપણે જે રીતે આગળ વધીશું તેમાં જાહેર જનતાનો ટેકો મળતો રહે તેવી માંગણી કરું છું.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ઢુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca